

FILATEX INDIA LIMITED

FIL/SE/2022-23/06 6th May, 2022

National Stock Exchange of India Limited

Listing Department 5th Floor, Exchange Plaza, C-1, Block-G. Bandra-Kurla Complex, Bandra (E) Mumbai-400 051 Security Symbol: FILATEX

BSE Limited

Listing Department 25th Floor, Pheroze Jeejeebhoy Towers Dalal Street. Mumbai - 400 001 Security Code: 526227

Sub.: Offer Opening Advertisement for the Buyback of Equity Shares of Filatex India Limited ('FIL' or 'the Company') through Tender Offer process in terms of the provisions of Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018.

Dear Sir/Madam.

With reference to the captioned subject and in furtherance to our earlier submission dated May 04, 2022, please find enclosed herewith the soft copy of Offer Opening Advertisement, published on May 06, 2022 in the below mentioned newspapers pursuant to the comments received by Securities & Exchange Board of India (SEBI):

- 1. All India editions of "Business Standard" (English)
- 2. All India editions of "Business Standard" (Hindi)
- 3. Vapi Edition of Divya Bhaskar (Gujrati Language)

This is for your information and record please.

For Filatex India Limited

Raman Kumar Jha

Company Secretary & Compliance Officer

CORPORATE OFFICE

E fildelhi@filatex.com

Bhageria House 43 Community Centre **New Friends Colony** New Delhi - 110025, India P +91.11.26312503.26848633/44 F+91.11.26849915

REGD. OFFICE & WORKS

S. No. 274 Demni Road Dadra - 396193 U.T. of-Dadra & Nagar Haveli India

P +91.260.2668343/8510 F+91.260.2668344 E fildadra@filatex.com

SURAT OFFICE Bhageria House

Ring Road Surat - 395002 India

Website: www.filatex.com

P+91.261.4030000 F+91.261.2310796 E filsurat@filatex.com **MUMBAI OFFICE**

321, Maker Chamber - v Nariman Point Mumbai - 400021 India P+91.22.22026005/06 F +91.22.22026006 E filmumbai@filatex.com



NMDC Limited
(A Govt. of India Enterprise)
10-3-311/A, Castle Hills, Masab Tank, Hyderabad-500028 CIN:L13100TG1958GOI001674.

CONTRACTS DEPARTMENT

Tender Notice (Open Tender Enquiry for Domestic Bidding) Tender Enquiry No: HO(Contracts)/Construction of Box Culvert/Bacheli Dep-5/2022/826 dated06-05-2022 [MSTC Ref.No.:NMDC/7/22-23/ET/74]

NMDC Limited, A "NAVARATNA" Public Sector Company under Ministry of Steel, Govt.of India invites online bids for CONSTRUCTION OF BOX CULVERT OVER NATURAL DRAIN FOR WASTE DUMP NO. 4 AT DEPOSIT-5, BIOM, BACHELI COMPLEX' on item rate basis, from prospective domestic bidders who fulfi the Pre-Qualification Criteria.

Detailed NIT and tender document including pre-qualification requirements can be viewed/downloaded from 06-05-2022 to 04-06-2022 from the following websites:

- 1. NMDC website: www.nmdc.co.in
- 2. Public Procurement Portal: http://www.eprocure.gov.in 3. MSTC portal: https://www.mstcecommerce.com/eprochome,

nmdc/buyer_login.jsp For accessing the bid document from NMDC website, the bidder has to register as "New User" at NMDC's website link

https://nmdcportals.nmdc.co.in/nmdctender For accessing the bid document from MSTC, bidder has to register as 'New Vendor' at MSTC website link https:// www.mstcecommerce.co.in/eprochome/nmdc buyer_login.jsp

and search the Tender Number NMDC/7/22-23/ET/74. For further help, refer to 'Vendor Guide' giveninMSTC website. The bidders are requested to submit their bids online through MSTC Limited website. The details of submission of bid through

online are given in NIT. The bidders on regular basis are required to visit the NMDC website CPP portal/MSTC website for corrigendum, if any, at a future date For further clarification, CGM (Contracts), NMDC Ltd. Hyderabad can be contacted on fax:040-23534746, Tel: 040-23532800, email:contracts@nmdc.co.in

Chief General Manager (Contracts)

हर एक काम देश के नाम इस्पाती इरादा

CREAMLINE DAIRY PRODUCTS LIMITED

CIN: U15201TG1986PLC006912

Registered Office: 6-3-1238/B/21, Asif Avenue, Raj Bhavan Rd, Somajiguda, Hyderabad, Telangana 500082. Website: www.creamlinedairy.com/ph.:+91-40-23412323
Fax: +91-40-23323353 Email: jersey@godrejcdpl.com

[Regulation 33 and Regulation 52 (8), read with Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (LODR Regulations)] EXTRACT OF STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR

S.		Quarter Ended	Quarter Ended	Year Ended	(Rs. in Lak Year Ende
No.		March 31,2022		March 31,2022	March 31.20
	Particulars	Audited	Audited	Audited	Audited
1	Total Income from Operations	33,668.69	28,008.35	1,17,500.13	1,03,223.9
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(577.19)	(419.00)	(3,234.53)	728.
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items#)	(577.19)	(419.00)	(4,962.86)	728.
1	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items#)	(434.78)	(273.89)	(3,665.61)	594.
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(444.14)	(258.46)	(3,687.52)	529.
ĵ	Paid up Equity Share Capital	1,132.47	1,132.47	1,132.47	1,132.
7	Reserves (excluding Revaluation Reserve)	8,251.28	12,844.77	8,251.28	12,844
3	Securities Premium Account	5,720.20	5,720.20	5,720.20	5,720
9	Net worth	15,103.95	19,697.44	15,103.95	19,697
10	Paid up Debt Capital/ Outstanding Debt*	20,556.05	2,023.44	20,556.05	2,023
11	Outstanding Redeemable Preference Shares	-	_		
12	Debt Equity Ratio	1.36	0.10	1.36	0
13	Earnings Per Share (Face Value of Rs.10/- per share) (for continuing and discontinued operations)				
	1. Basic	(3.84)	(2.42)	(32.37)	5
\Box	2. Diluted	(3.84)	(2.42)	(32.37)	5
14	Capital Redemption Reserve	_			
15	Debenture Redemption Reserve				
16	Debt Service Coverage Ratio	1.38	1.45	0.13	2
17	Interest Service Coverage Ratio xceptional and/or Extraordinary items adjusted in the	(1.14)	(9.88)	(5.64)	4

Represents total oustanding debt (Long Term & Short Term) as on the respective dates

The above is an extract of the detailed format of the Audited Financial Results for the Quarter and Year ended 31s March, 2022 filed with the Stock Exchange(s) under Regulation 33 and Regulation 52(4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Regulations, 2015 ("LODB Regulations"). The full format of the Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2022 are available on the website of the National Stock Exchange of India Limited (www.nseindia.com). The same is also made available on the website of the Company (www.reamilinedain.com).

Company (www.creaminedairy.com).

For the other line linems referred in Regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the National Stock Exchange of India Limited and can be accessed on the their website (www.nseindia.com). The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Neeting held on Thursday, 5th May, 2022. The Financial Results have been subjected to audit by the Statutory Auditors of the Company and the Auditors have expressed unmodified opinion.

By order of the Board of Directors o Creamline Dairy Products Limited

Place : Hyderabac Date: 5th May, 2022

K. Bhasker Reddy Managing Director DIN :00014291



BRIGADE

FORM No. INC-26

Pursuant to Rule 30 of the Companie (Incorporation) Rules, 2014]

Before the Regional Director. Eastern Region, Kolkata

the matter of Section 13(4) of the

Companies Act, 2013 and Rule 30(5)(a)

of the Companies (Incorporation) Rules

AND

n the matter of Oriental Carbon 8 Chemicals Limited (CIN : L24297WB1978PLC031539), having

ts Registered Office at 31, Netaji

Notice is hereby given to the General Public that the Company proposes to

make Application to the Regional

Director, Eastern Region, Ministry of Corporate Affairs under Section 13 of

the Companies Act, 2013, seeking

confirmation of alteration of the

Memorandum of Association of the

Company in terms of the Special

Resolution passed by way of Posta

Ballot on Wednesday, 27th April, 2022 o enable the Company to change its

Any person, whose interest is likely to

be affected by the proposed change of

the registered office of the Company

may deliver either on MCA Porta

(www.mca.gov.in) by filing investor

compliant form or cause to be delivered or send by registered post of

nis/her objections supported by an

affidavit stating the nature of his/he

he Regional Director, Eastern Region

linistry of Corporate Affairs, Nizam Palace, II M.S.O. Building, 3rd Floor

234/4, Acharya J C Bose Road, Kolkata

- 700 020, within fourteen days from he date of publication of this Notice with a copy to the Applicant Company at its Registered Office at the address

Oriental Carbon & Chemicals Limited

Pranab Kumar Maity Company Secretary& GM-Legal ICSI Membership No.20606

nentioned below: The Company Secretary Oriental Carbon & Chemicals Limited (CIN: L24297WB1978PLC031539)

Kolkata - 700 001

Date: 05.05.2022

, Netaji Subhas Road

terest and grounds of opposition to

Bengal" to "State of Gujarat"

Subhas Road, Kolkata - 700 001

BRIGADE PROPERTIES PRIVATE LIMITED

Corporate Identity Number (CIN): U70200KA2007PTC042824

Regd. Office: 29th Floor, World Trade Center, Brigade Gateway Campus, 26/1, Dr. Rajkumar Road.

Malleswaram-Rajajinagar, Bangalore 560 055.

Ph: +91-80-41379200, 2221 7017-18. Fax:+91-80-2221 0784. Email: investors@brigadegroup.com Website: www.brigadecosmopolis.com

Statement of Audited Financial Results for the quarter and year ended March 31, 2022

a. Statement of Financial Results

(₹ in Lakhs)

SI. No	Particulars	Quarter ended March 31, 2022	Preceding Quarter ended December 31, 2021	Corresponding Quarter ended March 31, 2021	Current year ended March 31, 2022	Previous year ended March 31, 2021
		[Audited] (refer note 9)	[Unaudited]	[Unreviewed] (refer note 3)	[Audited]	[Audited]
1.	Income					
	Revenue from operations	2,411	2,230	2,912	9,460	9,959
	Other income	64	79	51	618	236
2.	Total Income	2,475	2,309	2,963	10,078	10,195
۷.	Expenses Sub-contractor cost	349	383	493	1,092	1,770
	Cost of project materials consumed	42		42	48	474
	(Increase)/decrease in inventories of work-in-progress	(1,375)	(757)	(623)	(2,693)	(2,010)
	Employee benefits expense	20	14	18	70	60
	Finance costs	3,480	3,833	2,208	13,974	5,793
	Depreciation and amortization expense	2,656	2,716	2,171	10,770	6,348
	Other expenses	1,297	807	1,463	2,706	2,313
	Total Expenses	6,469	6,996	5,772	25,967	14,748
3.	Loss before exceptional items and tax (1-2)	(3,994)	(4,687)	(2,809)	(15,889)	(4,553)
4.	Exceptional item (refer Note 8 below)	2,038	-	1,778	4,132	1,778
5.	Loss before tax (3-4)	(6,032)	(4,687)	(4,587)	(20,021)	(6,331)
6.	Tax expense					
	(i) Current tax	(4.640)	(4.264)	- (4.224)	- (E GEO)	(4.042)
	(ii) Deferred tax charge/(credit) Total	(1,649) (1,649)	(1,364) (1,364)	(1,334) (1,334)	(5,659) (5,659)	(1,843) (1,843)
7.	Profit for the year (5-6)	(4,383)	(3,323)	(3,253)	(14,362)	(4,488)
8.	Other comprehensive income (net of tax expenses)	(4,303)	(3,323)	(3,233)	(14,302)	(4,400)
9.	Total comprehensive income for the period (7+8)	(4,383)	(3,323)	(3,253)	(14,362)	(4,488)
10.	Earnings Per Share (EPS) - (in Rs.)	(1,500)	(0,020)	(0,200)	(11,002)	(1,100)
	(not annualised, face value Rs.10)					
	a) Basic					
	Class A equity shares	-	-	-	-	-
	Class B equity shares	(11.24)	(8.53)	(8.39)	(36.86)	(11.64)
	Class C equity shares	(11.70)	(8.87)	(8.65)	(38.35)	(11.87)
	b) Diluted (refer Note 5 below)					
	Class A equity shares	- (44.04)	- (0.50)	- (0.00)	(00.00)	(44.04)
	Class B equity shares	(11.24)	(8.53)	(8.39)	(36.86)	(11.64)
11.	Class C equity shares Paid-up equity share capital	(11.70)	(8.87)	(8.65)	(38.35)	(11.87)
'''	(Face value per share - Rs. 10)	3,827	3,827	3,827	3,827	3,827
12.	Paid-up debt capital (refer Note 7 below)	45,604	45,337	32,228	45,604	32,228
13.	Other Equity	(9,732)	(5,993)	3,986	(9,732)	3,986
14.	Net worth (refer Note 7 below)	(5,905)	(2,166)	7,813	(5,905)	7,813
15.	Capital Redemption Reserve (CRR)	/		, <u>-</u>	- '	-
16.	Debenture Redemption Reserve (DRR)	1,319	1,319	1,319	1,319	1,319
17.	Ratios (refer Note 6 below)					
	a) Debt equity ratio	(24.84)	(67.70)	16.69	(24.84)	16.69
	b) Debt Service Coverage Ratio (DSCR)	(0.17)	(0.02)	(0.23)	(0.04)	0.01
	c) Interest Service Coverage Ratio (ISCR)	(0.21)	(0.30)	(0.26)	(0.20)	0.04
	d) CRR/DRR	-	-	-	-	-
	e) Current ratio	0.85	0.67	0.43	0.85	0.43
	f) Long term debt to working capital	(34.10)	(10.12)	(3.68)	(34.10)	(3.68)
	g) Bad debts to account receivable ratio h) Current liability ratio	0.16	0.22	- 0.21	0.16	0.21
	i) Total debts to total assets	0.16 0.91	0.23 0.90	0.31 0.80	0.16 0.91	0.31 0.80
	j) Debtors turnover	19.53	22.19	29.71	78.22	36.61
	k) Inventory turnover	19.55	22.19	0.01	-	0.07
	I) Operating margin %	- 24%	- 42%	- 22%	- 27%	10%
	m) Net profit margin %	-182%	-149%	-112%	-152%	- 45%
	my rest pront margin 70	- 102 /0	- 17370	-112/0	- 102 /0	- 40 /0

Brigade Properties Private Limited

Notes to the financial results for the guarter and year ended March 31, 2022

1 Brigade Properties Private Limited ('the Company' or 'BPPL') had issued 490 A Series Non-Convertible Debentures ('NCD') of Rs.10.00,000 each on March 20, 2015. which were listed on BSE Limited ('BSE') on March 30, 2015.

The above financial results of the Company for the quarter and year ended March 31, 2022 have been reviewed by the Audit Committee and taken on record at the meeting of the Board of Directors of the Company held on May 04, 2022. The statutory auditors of the Company have audited the financial results of the Company for the guarter and year ended March 31, 2022.

3 The figures for the corresponding quarter ended March 31, 2021, as reported in the accompanying Statement of financial results have been approved by the Company's Board of Directors, but have not been subjected to an audit/review

4 The Company's management has considered the possible effects that may result from the Covid-19 pandemic on the carrying value of assets including investment property, inventories including Transfer of Development Rights (TDR) and receivables. In developing the assumptions relating to the possible future uncertainties in the economic conditions because of this pandemic, the Company, as at the date of approval of these financial statements has used internal and external sources of information to assess the expected future performance of the Company. The Company has performed sensitivity analysis on the assumptions used and based on the current estimates, the Company expects that the carrying amount of these assets, as at the period end are fully recoverable

Due to the prevailing circumstances and having regard to the Company's ongoing discussions with its lessees for modification of existing lease contracts, the Company has recognised lease income on best estimate basis in accordance with Ind AS 116. Further, the Company's management has also made assessment of the progress of construction work on its ongoing projects during the period of lockdown and has concluded that the same was only a temporary slowdown in activities and has accordingly capitalised/inventorised the borrowing costs incurred in accordance with Ind AS 23. During the current year, the Company has incurred losses and has accumulated losses as at March 31, 2022. During the current year, the Company has received financial support from its

investors by way of fresh debenture subscription and also extension of repayment period of existing debentures. The Company is in the initial phase of its leasing operations and its ability to continue as a going concern is based on establishing profitable operations, availing unutilised bank borrowing limits and obtaining continuing financial support from its investors. The Company's management has also estimated the future cash flows for the Company with the possible effects that may result from the COVID-19 pandemic and does not foresee any adverse impact on its realising its assets and in meeting its liabilities as and when they fall due. The actual impact of the Covid-19 pandemic may be different from that estimated as at the

date of approval of these financial results. 5 In accordance with the Indian Accounting Standard (IND AS) - 33 Earnings Per Share, specified under Section 133 of the Companies Act, 2013, read with relevant rules issued thereunder,

6 (a) Debt equity ratio represents total debt [long-term borrowings (including current maturities) + short-term borrowings + interest accrued on borrowings] / total equity [equity share capital + other equityl.

DSCR represents profit/ loss from operations before finance cost (net of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised), exceptional items and tax expenses/ finance cost (gross of finance cost inventorised and charged to statement of profit and loss and gross of finance cost capitalised) plus principal repayment of loan funds during the period.

ISCR represents profit/ loss from operations before finance cost (net of finance cost inventorised and charged to statement of profit and loss and net of finance cost capitalised),

exceptional items and tax expenses/ finance cost (gross of finance cost inventorised and charged to statement of profit and loss and gross of finance cost capitalised). CRR/DRR represents Capital Redemption Reserve (CRR) / Debenture redemption reserve (DRR).

Current ratio represents total current assets / total current liabilities.

Long term debt to working capital represents non-current borrowings / working capital [current assets-current liabilities]. Bad debts to account receivable ratio represents Bad debts incurred during the period / Average of opening and closing balances of Trade Receivables.

Current liability ratio represents current liabilities / total liabilities. Total debts to total assets represents total debts [long-term borrowings, short-term borrowings and interest accrued (included in other financial liabilities)] / total assets.

Debtors turnover represents Revenue from operations / Average of opening and closing balances of Trade Receivables. Inventory turnover represents Cost of sales [Sub-contractor cost + Cost of project materials consumed + (Increase) / decrease in inventories of work-in-progress + finance cost

inventorised] / Average of opening and closing balances of inventories.

Operating margin % represents Operating profit [Loss before exceptional items and tax - Other income + Finance cost] / Revenue from operations.

there are certain class of securities which are anti dilutive and hence the impact of those securities has been ignored in the computation of diluted EPS.

(m) Net profit margin % represents Profit for the year/Revenue from operations. Paid up debt capital represents outstanding debt portion of redeemable preference shares and optionally convertible debentures, non convertible debentures and fully convertible debentures issued by the Company and interest outstanding thereon. Net worth represents total equity, i.e., sum of equity share capital and other equity.

During the year ended March 31, 2021, based on the ongoing proceedings with the relevant regulatory authorities and management's assessment thereon, the Company had ascertained Rs.1,778 lakhs as the amount of stamp duty payable pursuant to the merger of the Company and its wholly-owned subsidiary Brookefields Real Estates and Projects Private Limited ('BREPPL'), which was provided for and disclosed as an exceptional item. On July 05, 2021, the Company has received final assessment order from the Karnataka Stamps and Registration Department with an assessed stamp duty payable of Rs.3,872 lakhs.

The balance amount of Rs.2,094 lakhs has been provided for during the current year and disclosed as an exceptional item. The Company is in the process of executing its inventory project. In this regard, during the current quarter, the Company has made changes to its existing project plan and consequently certain portion of the inventory aggregating to Rs.2,038 lakks is being discarded and no future economic benefits are expected from its disposal. Accordingly, during the current quarter,

the same has been written off by the Company and has been recognised in the Statement of profit and loss as an exceptional item. 9 The figures of the last quarter are the balancing figures between audited figures in respect of the full financial year up to March 31, 2022 and the unaudited published year-to-date figures up

to December 31, 2021, being the date of the end of the third quarter of the financial year which were subjected to limited review.

Place: Bengaluru, India Date: May 04, 2022

For and on behalf of the Board of Directors of **Brigade Properties Private Limited**

FILATEX INDIA LIMITED

Registered Office: Survey No. 274, Demni Road, Dadra, Union Territory of Dadra and Nagar Haveli – 396191 Tel.: 0260-2668343, 2668510, Fax: 0260-2668343, 2668344

Corporate Office: Bhageria House 43, Community Centre, New Friends Colony, New Delhi - 110025
Phone: 011-26312503, 26848633/44, Fax: 011-26849915
Website: www.filatex.com; E-mail: secretarial@filatex.com

Contact Person: Mr. Raman Kumar Jha, Company Secretary & Compliance Officer

FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF FILATEX INDIA LIMITED ("THE COMPANY") (TO WHOM THE LETTER OF OFFER DATED APRIL 29, 2022, ALONGWITH TENDER FORM AND SHARE TRANSFER FORM, HAS BEEN DISPATCHED THROUGH EMAIL WHOSE E-MAIL IDS WERE AVAILABLE AND TO THE SHAREHOLDERS. HOLDING SHARES IN PHYSICAL MODE AND WHOSE EMAIL IDS WERE NOT AVAILABLE. PRINTED COPIES HAVE BEEN DISPATCHED AT THEIR LAST KNOWN ADDRESSES THROUGH PHYSICAL POST ON MAY 04, 2022 FOR THE BUYBACK OF EQUITY SHARES THROUGH TENDER OFFER ROUTE. UNDER THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (BUY-BACK OF SECURITIES) REGULATIONS

The Company proposed an offer for buyback of upto 42,50,000 (Forty Two Lakh and Fifty Thousand Only) fully paid-up equity shares of the Company of face value of Rs. 2/- (Rupees Two Only) each ("equity shares") at a price of Rs. 140/- (Rupees One Hundred Forty Only) per equity share on a proportionate basis through the tender offer process. The brief schedule of activities for the buyback is a

Activity	Date	Day
Completion of Dispatch of Letter of Offer	May 04, 2022	Wednesday
Buyback Opening Date	May 09, 2022	Monday
Buyback Closing Date	May 23, 2022	Monday
Last date for the receipt of completed Tender Forms and other specified documents	May 23, 2022	Monday
including physical share certificates (as applicable) by the Registrar to the Buyback		-

It may please be noted that even the Eligible Shareholders holding Equity Shares in physical form are eligible to tender their

For the purpose of this Buyback offer the Eligible Shareholders means the person(s) eligible to participate in the Buyback Offer and would mean all Equity Shareholders/ beneficial owners of Equity Shares of the Company as on the Record Date being Friday, April 08, 2022.

For detailed process of tendering of shares (by physical shareholders as well as the shareholders holding shares in dematerialise form), please refer to para 20 at page number 50 of the Letter of Offer.

lt may please be noted that the application of tendering shares either by physical shareholders or shareholders holding shares in dematerialised form is to be made through stock exchange mechanism only, by Acquisition Window of the National Stocl Exchange of India Limited ("NSE").

If in case, any shareholder has not received the Letter of Offer, then he/she may participate in the Buyback either by providing application in writing to the stock broker, on plain paper signed by the Equity Shareholder stating name, address, folio number, number of Equity Shares held, share certificate number, number of Equity Shares tendered for the Buyback and the distinctive numbers thereof, enclosing the original share certificate(s), copy of Equity Shareholders' PAN card(s) and executed share transfer form in favour of the Company of they can download the Letter of Offer, Tender Form and share transfer form SH-4 from the websites of the Company, the Registrar to the Buyback, the Stock Exchanges and the Manager to the Buyback at www.filatex.com, www.mcsregistrars.com, www.nseindia.com www.bseindia.com and www.corporateprofessionals.com respectively.

The direct web link of the website of the Registrar to Buyback Offer for downloading the Letter of Offer, Tender Form and share transfe form SH-4 is https://mcsregistrars.com/buyback/filatex.php.

For more information, you may contact the Manager, the Registrar or the Company Secretary of the Company: MANAGER TO THE BUYBACK OFFER REGISTRAR TO THE BUYBACK

Corporate **Professionals**

Corporate Professionals Capital Private Limited D-28, South Extension Part-1, New Delhi – 110049, India Tel: 011-40622230/ 40622251/ 40622209; Contact Person: Ms. Anjali Aggarwal, Email: mb@indiacp.com Website: www.corporateprofessionals.com Investor grievance e-mail: mb@indiacp.com SEBI Registration No.: INM000011435

Validity Period : Permanent

CIN: U74899DL2000PTC104508



MCS Share Transfer Agent Limited F-65, Okhla Industrial Area, Phase – I, New Delhi, Delhi – 110020, India **Tel:** +011-41406148/49/52: Fax: +011-41709881

Contact Person: Mr. Amariit Email: admin@mcsregistrars.com Website: www.mcsregistrars.com SEBI Registration No.: INR000004108 Validity Period: Permanent CIN: U67120WB2011PLC165872

> For and on behalf of Filatex India Limited Raman Kumar Jha

Date: May 05, 2022 Company Secretary & Compliance Officer Place: New Delhi (Membership No. F8086)

ब्याज बढ़ोतरी से शेयरों में उतारचढ़ाव

कारोबारी सत्र के दौरान बीएसई सेंसेक्स में 950 अंकों की घटबढ़ देखने को मिली

मुंबई, 5 मई



अमेरिकी बाजारों में तीन फीसदी की बढोतरी के बाद बेंचमार्क सेंसेक्स शुरुआती कारोबार में करीब 900 अंक चढ़कर खुला। हालांकि कारोबारी सत्र के दौरान इंडेक्स के दिग्गजों में बिकवाली के कारण इंडेक्स ने अपनी बढत करीब-करीब गंवा दी।

सेंसेक्स अंत में 33 अंकों की बढत के साथ 55,702 पर बंद हुआ। दूसरी ओर, निफ्टी महज 5 अंकों की बढत के साथ 16,682 पर टिका। मंगलवार को दोनों सूचकांकों ने दो महीने की सबसे बड़ी गिरावट दर्ज की थी जब आरबीआई ने अचानक दरों में बढ़ोतरी

विदेशी पोर्टफोलियो निवेशकों (एफपीआई) ने 2,075 करोड़ रुपये के शेयर बेचे जबिक देसी संस्थान 2,229 करोड़ रुपये के शुद्ध खरीदार रहे।

सेंटिमेंट पर इसलिए भी असर पड़ा क्योंकि अमेरिकी फ्यूचर मार्केट ने वॉल बाजारों का हाल



■ सेंसेक्स अंत में 33 अंकों की बढत के साथ 55,702 पर बंद हुआ। दूसरी ओर, निफ्टी महज 5 अंकों की बढ़त के साथ 16,682 पर टिका

- विदेशी पोर्टफोलियो निवेशकों (एफपीआई) ने 2,075 करोड़ रुपये के शेयर बेचे जबिक देसी संस्थान 2,229 करोड़ रुपये के शुद्ध खरीदार रहे
- कच्चे तेल की कीमतों में बढोतरी ने भी भारत में निवेशकों की अवधारणा पर असर डाला
- 🛮 गुरुवार को ब्रेंट क्रूड 1.6 फीसदी की बढ़त के साथ 112.5 डॉलर पर कारोबार कर रहा था

स्ट्रीट पर कमजोर शुरुआत का संकेत दिया क्योंकि महंगाई का डर एक बार फिर सामने आया। बुधवार को एसऐंडपी 500, 3 फीसदी उछल गया जब फेडरल रिजर्व के प्रमुख जीरोम पॉवेल की टिप्पणी ने इस अफवाह को खारिज कर दिया कि फेड आगामी महीनों में ब्याज दरों में 75 आधार अंकों का इजाफा करने पर विचार कर रहा है।

फेडरल रिजर्व ने साल 2000 के बाद पहली बार ब्याज दरों में 50 आधार अंकों का इजाफा किया और अगली बैठकों में भी ऐसे ही कदमों का संकेत दिया। अमेरिकी सेंट्रल बैंक ने अपनी बैलेंस शीट में कमी लाने की योजना का भी अनावरण किया। हालांकि पाॅवेल ने कहा कि मौद्रिक नीति की समिति सक्रियता से 75 आधार अंकों की बढ़ोतरी पर विचार नहीं कर रही है, इससे बाजार में तेजी देखने को मिली।

अल्फानीति फिनटेक के सह-संस्थापक य आर भटट ने कहा. फेडरल रिजर्व की ब्याज बढोतरी उम्मीद के मुताबिक है। साथ ही चेयरमैन के बयान ने ब्याज में ज्यादा बढोतरी का डर निकाल दिया। ऐसे में इक्विटी पर बहुत ज्यादा असर नहीं दिखने जा रहा। इसके उलट आरबीओी की दरों में बढोतरी की घोषणा अनियत थी। भविष्य को लेकर संदेश भी स्पष्ट है, जिसके कारण कल बाजार में घमासान दिखा था।

एवेंडस कैपिटल के सीईओ एंडय हॉलैंड ने कहा, निवेशकों को और उतारचढ़ाव देखने को मिलेंगे। उन्होंने कहा, जून से सख्ती शुरू होने जा रही है। इसका असर जुलाई-सितंबर में दिखना शुरू होगा। इसके परिणाम सितंबर में दिखने शुरू होंगे। बैंक ऑफ इंगलैंड का कहना है कि अर्थव्यवस्था अगले साल नीचे आ सकती है और वे अभी भी दरें बढा रहे हैं और यहीं समस्या छिपी हुई है।

कच्चे तेल की कीमतों में बढोतरी ने भी भारत में निवेशकों की अवधारणा पर असर डाला। कच्चे तेल की कीमतें पिछले दो दिन से बढ़ रही है जब यूरोपियन यूनियन ने छह महीने में रूसी तेल आयात को बंद करने की योजना का ऐलान किया। गुरुवार को ब्रेंट क्रुड 1.6 फीसदी की बढ़त के साथ 112.5

एलआईसी आईपीओ के लिए रविवार को खुली रहेंगी चुनिंदा बैंक शाखाएं

बीएस संवाददाता

मुंबई, 5 मई

भारतीय रिजर्व बैंक ने अस्बा (ऐप्लिकेशन सपोर्टेड बाय ब्लॉक्ड अकाउंट) डेजिग्नेटेड सभी बैंक शाखाओं को रविवार को अपनी शाखा खोलने का निर्देश दिया है ताकि भारतीय जीवन बीमा निगम के आरंभिक सार्वजनिक निर्गम के लिए बोली लगाने में किसी तरह की परेशानी न हो।

आरबीआई ने एक परिपत्र में कहा है, एलआईसी के आईपीओ में बोली लगाने की सविधा देने के लिए भारत सरकार ने अस्बा डेजिंग्नेटेड सभी बैंक शाखाओं को एलआईसी आईपीओ के अस्बा आवेदन की प्रोसेसिंग के लिए अपनी शाखाएं रविवार 8 मई को खोलने का अनुरोध किया है। इस मामले की जांच की गई और फैसला लिया गया है कि बैंक अपनी-अपनी अस्बा डेजिग्नेटेड शाखाएं इस मकसद के लिए 8 मई को खोल सकती हैं।

अस्बा एक तरह की व्यवस्था है, जिसके जरिये निवेशक किसी सार्वजनिक निर्गम में शेयरों के लिए आवेदन करते हैं। दिलचस्प रूप से यह आईपीओ सप्ताहांत में भी आवेदन के लिए खुला रहेगा क्योंकि सरकार बाजार से बड़ी रकम जुटाने जा रही है।

एलआईसी का आईपीओ बुधवार को खुला और पहले दिन 67 फीसदी आवेदन मिले, जिसमें उसे पॉलिसीधारकों, कर्मचारियों व खुदरा निवेशकों का समर्थन मिला। यह इश्य ९ मई तक खला रहेगा।

ताजा आंकड़े बताते हैं कि आईपीओ को 73 फीसदी आवेदन मिल चके हैं और पॉलिसीधारकों की श्रेणी में 2.2 गुना और कर्मचारियों के लिए आरक्षित श्रेणी में 1.39 गुना आवेदन मिले जबकि खुदरा श्रेणी में 0.67 फीसदी आवेदन हासिल हुए।

बीमा दिग्गज ने सोमवार को एंकर निवेशकों से 5.627 करोड रुपये जटाए और इसकी 71 फीसदी रकम देसी म्युचुअल फंडों से मिली। बीमा कंपनी ने 123 निवेशकों को 949 रुपये प्रति शेयर पर करीब 5.93 करोड शेयर आवंटित किए।

डेल्हिवरी का आईपीओ 10 मई को खुलेगा

बीएस संवाददाता मुंबई, 5 मई

लॉजिस्टिक्स दिग्गज डेल्हिवरी का 5,235 करोड़ रुपये का आरंभिक सार्वजनिक निर्गम (आईपीओ) 10 मई को खुलकर 12 मई को बंद होगा। यह पेशकश भारतीय जीवन बीमा निगम के आईपीओ के बाद साल का दूसरा सबसे बड़ा आईपीओ होगा। कीमत दायरे के ऊपरी स्तर 487 रुपये प्रति शेयर पर कंपनी का बाजार मूल्यांकन 35,284 करोड़ रुपये होगा। इस आईपीओ में कंपनी नए शेयर जारी कर 4,000 करोड़ रुपये जुटाने जा रही है। बाकी 1,235 करोड रुपये का ओएफएस होगा, जिसमें प्राइवेट इक्विटी फर्म कार्लाइल व सॉफ्टबैंक अपने शेयर बेचेगी।

कंपनी खुद के दम पर बढ़त हासिल करने के लिए आईपीओ की रकम का 2,000 करोड़ रुपये लगाएगी जबिक 1,000 करोड रुपये का इस्तेमाल विलय-अधिग्रहण पर करेगी।

पिछले पांच साल में कंपनी ने बढ़त हासिल करने के लिए आधा दर्जन से ज्यादा रणनीतिक गठजोड व अधिग्रहण किया है।

डेल्हिवरी का आईपीओ एक बार फिर उच्च बढत वाली पर नुकसान उठाने वाली कंपनी में निवेश की निवेशकों की इच्छा की परख करेगा। गुरुवार को आयोजित

प्रेस कॉन्फ्रेंस में कंपनी ने कहा कि वह अपना परिचालन लाभ सुधारने में कामयाब रही है जबकि उसने क्षमता तैयार करने में लगातार निवेश किया। साथ ही उसने अपने राजस्व में तेजी से बढ़ोतरी दर्ज की है। कंपनी का समायोजित एबिटा वित्त वर्ष 2019 के -11.35 फीसदी के मकाबले वित्त वर्ष 21 में -6.95 फीसदी रहा। कंपनी का परिचालन लाभ ओयो, फार्मईजी, पेटीएम व जोमैटो जैसे स्टार्टअप से तुलनायोग्य है, जिसका समायोजित एबिटा वित्त वर्ष 21 में -59 फीसदी से लेकर 15.3 फीसदी के बीच रहा है।

पिछले साल बाजार में स्टार्टअप व नई पीढी की तकनीकी कंपनियों के आईपीओ देखने को मिले थे। हालांकि बाजार के बदलते आयाम ने इस क्षेत्र से हो रही शेयर बिक्री पर ब्रेक लगा दिया। इस साल अब तक वैश्विक स्तर पर 50 करोड़ डॉलर से ज्यादा के 2-3 टेक आईपीओ पेश हुए हैं, जिसमें इंडोनेशिया की कंपनी गोटो गोजेक

निवेश बैंकरों ने कहा कि डेल्हिवरी के आईपीओ का आकार व मूल्यांकन बाजार की स्थिति और निवेशकों की प्रतिक्रिया हासिल करने के बाद फिर से तय किया गया है। उनका कहना है कि 10 मई को एंकर आवंटन देसी व विदेशी संस्थागत निवेशकों की तरफ से मजबत मांग का पप्रदर्शन

नियामकीय बदलाव से बढ़ी पारदर्शिता: एनएसई

बीएस संवाददाता मुंबई, 5 मई

अग्रणी एक्सचेंज नैशनल स्टॉक एक्सचेंज ने कहा है कि बाजार नियामक की तरफ से क्लाइंट के फंडों को लेकर किए गए सिलसिलेवार बदलाव ने शेयर बाजार में पारदर्शिता में इजाफा किया है और जोखिम प्रबंधन में सुधार किया है।

2 मई से बाजार नियामक सेबी ने ब्रोकरों को एक क्लाइंट के कोलेटरल फंड का इस्तेमाल दूसरे क्लाइंट के मार्जिन की फंडिंग में करने से रोक दिया है। इस मामले में ब्रोकरों को क्लाइंट के स्तर पर कोलेटरल की सचना देनी होगी और इसमें नाकाम होने पर उन पर भारी जुर्माना लगाया

सितंबर 2020 में नियामक ने पावर ऑफ अटॉर्नी क्री पुरानी व्यवस्था को कथित तौर पर मार्जिन प्लेज व री-प्लेज मेकेनिज्म से बदल दिया। ब्रोकरों की तरफ से क्लाइंट के फंडों का

Completion of Dispatch of Letter of Offer

Buyback Opening Date

being Friday, April 08, 2022



2 मई से बाजार नियामक सेबी ने ब्रोकरों को एक क्लाइंट के कोलेटरल फंड का इस्तेमाल दूसरे क्लाइंट के मार्जिन की फंडिंग में करने से रोक दिया है

दुरुपयोग किए जाने के बाद यह कदम उठाया गया। अक्टूबर 2021 में सेबी ने एक्सचेंजों, क्लियरिंग कॉरपोरेशन व ब्रोकरों को टी प्लस 1

May 04 2022

May 09, 2022

May 23, 2022

May 23, 2022

REGISTRAR TO THE BUYBACK

F-65, Okhla Industrial Area, Phase – I. New Delhi, Delhi – 110020, India

For and on behalf of Filatex India Limited

MCS Share Transfer Agent Limited

Tel: +011-41406148/49/52;

Contact Person: Mr. Amariit

Validity Period: Permanent

Email: admin@mcsregistrars.com

Website: www.mcsregistrars.com

CIN: U67120WB2011PLC165872

SEBI Registration No.: INR000004108

Fax: +011-41709881

Monday

FILATEX INDIA LIMITED

Registered Office: Survey No. 274, Demni Road, Dadra

Union Territory of Dadra and Nagar Haveli – 396191 Tel.: 0260-2668343, 2668510, Fax: 0260-2668343, 2668344

Corporate Office: Bhageria House 43, Community Centre, New Friends Colony, New Delhi - 110025 Phone: 011-26312503, 26848633/44, Fax: 011-26849915

Website: www.filatex.com; E-mail: secretarial@filatex.com

Contact Person: Mr. Raman Kumar Jha, Company Secretary & Compliance Officer

FOR THE ATTENTION OF **FOUITY SHAREHOLDERS OF FILATEX INDIA LIMITED ("THE COMPANY")** (TO WHOM THE LETTEF

OF OFFER DATED APRIL 29, 2022, ALONGWITH TENDER FORM AND SHARE TRANSFER FORM, HAS BEEN DISPATCHED

THROUGH FMAIL WHOSE F-MAIL IDS WERE AVAILABLE AND TO THE SHAREHOLDERS. HOLDING SHARES IN PHYSICAL MODE AND WHOSE EMAIL IDS WERE NOT AVAILABLE. PRINTED COPIES HAVE BEEN DISPATCHED AT THEIR LAST KNOWN

ADDRESSES THROUGH PHYSICAL POST ON MAY 04, 2022 FOR THE BUYBACK OF EQUITY SHARES THROUGH TENDER

OFFER ROUTE, UNDER THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (BUY-BACK OF SECURITIES) REGULATIONS

The Company proposed an offer for buyback of upto 42,50,000 (Forty Two Lakh and Fifty Thousand Only) fully paid-up equity shares

of the Company of face value of Rs. 2/- (Rupees Two Only) each ("equity shares") at a price of Rs. 140/- (Rupees One Hundred Forty

Only) per equity share on a proportionate basis through the tender offer process. The brief schedule of activities for the buyback is a

For the purpose of this Buyback offer the Eligible Shareholders means the person(s) eligible to participate in the Buyback

Offer and would mean all Equity Shareholders/ beneficial owners of Equity Shares of the Company as on the Record Date

For detailed process of tendering of shares (by physical shareholders as well as the shareholders holding shares in dematerialised

It may please be noted that the application of tendering shares either by physical shareholders or shareholders holding shares

in dematerialised form is to be made through stock exchange mechanism only, by Acquisition Window of the National Stock

If in case, any shareholder has not received the Letter of Offer, then he/ she may participate in the Buyback either by providing application

in writing to the stock broker, on plain paper signed by the Equity Shareholder stating name, address, folio number, number of Equity

Shares held, share certificate number, number of Equity Shares tendered for the Buyback and the distinctive numbers thereof, enclosing

the original share certificate(s), copy of Equity Shareholders' PAN card(s) and executed share transfer form in favour of the Company o

they can download the Letter of Offer. Tender Form and share transfer form SH-4 from the websites of the Company, the Registrar to the

Buyback, the Stock Exchanges and the Manager to the Buyback at www.filatex.com, www.mcsregistrars.com, www.nseindia.com

The direct web link of the website of the Registrar to Buyback Offer for downloading the Letter of Offer, Tender Form and share transfe

For more information, you may contact the Manager, the Registrar or the Company Secretary of the Company:

Last date for the receipt of completed Tender Forms and other specified documents

including physical share certificates (as applicable) by the Registrar to the Buyback

form), please refer to para 20 at page number 50 of the Letter of Offer.

www.bseindia.com and www.corporateprofessionals.com respectively

form SH-4 is https://mcsregistrars.com/buyback/filatex.php.

MANAGER TO THE BUYBACK OFFER

Professionals

D-28. South Extension Part-1. New Delhi – 110049. India

Corporate

Corporate Professionals Capital Private Limited

Tel: 011-40622230/ 40622251/ 40622209;

Website: www.corporateprofessionals.com

SEBI Registration No.: INM000011435

Investor grievance e-mail: mb@indiacp.com

Contact Person: Ms. Anjali Aggarwal,

Email: mb@indiacp.com

Validity Period : Permanent

CIN: U74899DL2000PTC104508

के आधार पर क्लाइंटों के नकदी कोलेटरल का खुलासा करने का निर्देश दिया।

एनएसई क्लियरिंग के प्रबंध निदेशक विक्रम कोठारी ने कहा, कोलेटरल पर नियामकीय दिशानिर्देश पारदर्शिता और निवेशकों के कोलेटरल का पता लगाने के इरादे से तैयार किया गया है, जो वैयक्तिक कोलेटरल को अलग-अलग करता है और सभी निवेशकों को सरक्षा देता है। साथ ही लाभ में सुधार और कोलेटरल की त्वरित वापसी भी मुहैया कराता है।

अभी एनएसई क्लियरिंग करीब 5 करोड़ निवेशकों के कोलेटरल खाते अपने पास बनाए हए है, जिसकी पहचान विभिन्न ब्रोकरों के तहत होती है। यह क्लाइंटों की प्रतिभृतियों व नकद कोलेटरल की सरक्षा वैयक्तिक आधार पर करने में सक्षम बनाता है।

एक्सचेंज के अधिकारियों ने कहा कि उन्होंने ब्रोकरों की निगरानी और किसी तरह के दुरुपयोग के शुरुआती संकेत की जानकारी हासिल कनरे के लिए सिलसिलेवार कदम उठाए हैं।

सोने और चांदी

वैश्विक बाजारों में तेजी के रुख

के अनुरूप दिल्ली सराफा बाजार

में गुरुवार को सोना 559 रुपये की

तेजी के साथ 51.081 रुपये प्रति

10 ग्राम हो गया। एचडीएफसी

सिक्योरिटीज ने यह जानकारी दी।

इससे पिछले कारोबारी सत्र में सोना

50,522 रुपये प्रति 10 ग्राम पर बंद

हुआ था। चांदी की कीमत भी

1,179 रुपये उछलकर 63,427 रुपये

प्रति किलोग्राम पर पहुंच गई। पिछले

कारोबारी सत्र में चांदी 62,248 रुपये

प्रति किलोग्राम पर बंद हुई थी। *भाषा*

आरबीआई की ब्याज दर वृद्धि

बैंकों के शुद्ध ब्याज मार्जिन, लाभ पर पड़ेगा कम असर

दर वृद्धि का बैंकिंग व्यवस्था में मार्जिन पर ज्यादा नकारात्मक प्रभाव पड़ने की आशंका नहीं है

निकिता विशष्ठ नई दिल्ली, 5 मई

विश्लेषकों का कहना है कि आरबीआई द्वारा रीपो दर और नकदी आरक्षी दर (सीआरआर) में वृद्धि से बैंकों पर बहुत ज्यादा दबाव नहीं पड़ेगा, क्योंकि उन्हें बाह्य बेंचमार्क से जुड़े उधारी पोर्टफोलियो पर ऊंचे प्रतिफल का लाभ मिलेगा। हालांकि गैर-बैंकिंग वित्तीय कंपनियों (एनबीएफसी) को ज्यादा नुकसान हो सकता है।

मोतीलाल ओसवाल फाइनैंशियल सर्विसेज विश्लेषकों का कहना है, 'अग्रिम वृद्धि में तेजी, सुधरते परिसंपत्ति मिश्रण और नीतिगत दरों में लगातार वृद्धि से वित्त वर्ष 2023 के लिए ऊंचे प्रतिफल को बढावा मिलेगा। हालांकि जमा दरों में वृद्धि और मांग परिवेश में ठोस सुधार पर भी नजर रखने की जरूरत होगी, लेकिन हम बैंकिंग व्यवस्था में मार्जिन को लेकर सकारात्मक बने हुए हैं।'

शेयर बाजारों पर. निफ्टी बैंक फाइनैंशियल सर्विसेज सुचकांक दिन के कारोबार में करीब 2-2 प्रतिशत की तेजी के बाद सपाट बंद हुए। निफ्टी बैंक 0.09 प्रतिशत नीचे आ गया, जबिक फाइनैंशियल सर्विसेज सूचकांक 0.15 प्रतिशत की बढत के साथ बंद हुआ। तुलनात्मक तौर पर निफ्टी-50



 आरबीआई द्वारा रीपो दर और नकदी आरक्षी दर (सीआरआर) में वृद्धि से बैंकों पर बहुत ज्यादा दबाव नहीं पड़ेगा, क्योंकि उन्हें बाह्य बेंचमार्क से जुड़े उधारी पोर्टफोलियो पर ऊंचे प्रतिफल का

■हालांकि गैर-बैंकिंग वित्तीय कंपनियों (एनबीएफसी) को ज्यादा नुकसान हो सकता है

चढ़कर बंद हुआ। विश्लेषकों के अनसार, रीपो दर

में वृद्धि से जमा और उधारी दरों में तेजी को बढावा मिलेगा, जो पीएसयू बैंकों के मुकाबले निजी बैंकों के लिए ज्यादा अनुकुल होगा। ऐसा इसलिए है, क्योंकि रीपो दरों के लिए बाह्य बेंचमार्क दर (ईबीआर)-केंद्रित ऋण का अनुपात दिसंबर 2021 तक बढ़कर 57 प्रतिशत हो गया, जबकि पीएसयू बैंकों के लिए यह 28 प्रतिशत पर था।

आईसीआईसीआई सिक्योरिटीज के विश्लेषण से पता चलता है कि पीएसय बैंकों की फ्लोटिंग दर वाले

60 प्रतिशत से ज्यादा ऋण अभी भी एमसीएलआर से जुड़े हुए हैं।

ब्रोकरेज का कहना है कि वाहन और पर्सनल/कंटिंजेंसी/गोल्ड जैसे बडे उद्योगों के लिए 71 प्रतिशत/60 प्रतिशत/61 प्रतिशत ऋण अभी भी एमसीएलआर से जुड़े हुए हैं और इन सेगमेंटों को बैंकों द्वारा एमसीएलआर में बदलाव किए जाने का लाभ मिलेगा।

मार्जिन और प्रतिफल पर प्रभाव

जेफरीज के अनुसार, रीपो दर में वृद्धि से बैंकों को रिटेल और एसएमई दरें बढाने में मदद मिलेगी।

ब्रोकरेज फर्म का मानना है कि वित्त वर्ष 2023 में एनआईएम में 5 आधार अंक के बदलाव का कर-पूर्व लाभ (पीबीटी) अनुमानों पर 1-4 प्रतिशत तक प्रभाव पड़ सकता है।

ब्रोकरेज ने कहा है, 'प्रभावी दर वद्धि सीआरआर और ऋण मूल्य निर्धारण में बदलाव के प्रभाव के साथ समायोजित होगी। हालांकि इनका मार्जिन पर अनुकूल असर हो सकता है, लेकिन पिछले कुछ वर्षों के दौरान बैंक सीमित दायरे में एनआईएम को बरकरार रखने में सफल रहे थे और हमें यह रुझान बरकरार रहने की संभावना है।'

आईसीआईसीआई सिक्योरिटीज का मानना है कि थोक बिक्री जमाओं में 125 आधार अंक की वृद्धि और छोटी सावधि जमाओ में 100 आधार अंक वृद्धि का कुल जामाओं की लागत पर 30-40

आधार अंक का प्रभाव पडेगा। उसका मानना है कि कुल मिलाकर, एक साल की अवधि में 100 आधार अंक की ब्याज दर वृद्धि का शुद्ध ब्याज आय (एनआईआई) पर 2-5 प्रतिशत और परिसंपत्ति पर प्रतिफल (आरओए) पर 5-15 आधार अंक का अनुकूल असर पडने की संभावना है।

पिछले दो दिनों में 10 वर्षीय बॉन्ड प्रतिफल 4 प्रतिशत तक चढ गया था और गुरुवार को यह 7.4 प्रतिशत के स्तर पर पहुंच गया।



एनएमडीसी लिमिटेड _(भारत सरकार का उद्यम) ानिज भवन, 10-3-311/ए, कैसल हिल्स, मासाब टैंक, हैदराबाद-500028. सीआईएन-L13100TG1958GO1001674

ई-निविदा सूचना (घरेलू बोली के लिए खुली निविदा पूछताछ) निविदा पूछताछ सं : मु. (संविदा)/कंस्ट्रक्शन ऑफ बॉक्स कलवर्ट/बचेली डिप-5/2022/826 दिनांक : 06/05/2022

एनएमडीसी लिमिटेड इस्पात मंत्रालय, भारत सरकार के अधीन सार्वजनिक क्षेत्र की एक "नवरत्न" कंपनी है जो "निक्षेप-5, बीआईओएम, बचेली कॉम्पलेक्स में अपशिष्ट डम्प के लिए नेचुरल ड्रेन के ऊपर बॉॅंक्स कलवर्ट के निर्माण" के लिए प्रत्याशित घरेलू बोलीकर्ताओं जो पूर्व-योगयता मानदंड को पूरा करते हों, से मद दर आधार पर

संविदा विभाग

विस्तृत एनआईटी एवं अपेक्षित पूर्व-योगयता सहित निविदा कागजात निम्नांकित वेबसाइट पर 06-05-2022 से 04-06-2022 तक अवलोकन तथा/अथवा डाउन लोड किए जा सकते हैं :

1.एनएमडीसी वेबसाइट-http://www.nmdc.co.in

2. केंद्रीय सार्वजनिक खरीद पोर्टल-https://www.eprocure.gov.in 3. एमएसटीसी पोर्टल-https://www.mstcecommerce.com/eprochome/ nmdc/buyer_login.jsp

के वेबसाइट लिंक http://nmdcportals.nmdc.co.in/nmdctender पर एमएसटीसी पोर्टल से बोली कागजातों की एक्सेसिंग के लिए, बोलीकर्ता को एमएसटीसी वे

हैदराबाद, फैक्स सं.+91-040-23534746, दूरभाष सं +91-040-23532800,

ई-मेल : contracts@nmdc.co.in पर संपर्क किया जा सकता हैं ।

पुनीत वाधवा (एमएसटीसी संदर्भ सं. एनएमडीसी/एचओ/7/22-23/ईटी/74)

एनएमडीसी वेबसाइट से बोली कागजातों की एक्ससिंग के लिए बोलीकर्ता को एनएम.दीमी 'नए उपयोगकर्ता' के रुप में पंजीकरण करना होगा ।

वेबसाइट लिंक http://www.mstcecommerce.co.in/eprochome/ nmdc/buyer_login.jsp पर 'नए वेंडर' के रुप में पंजीकरण करना होगा तथा निविदा सं : एनएमडीसी /एचओ/7/22-23/ईटी/74 के माध्यम से निविदा सर्च करना होगा अतिरिक्त सहायता के लिए कृपया एमएसटीसी के वेबसाइट पर दिए गए वेंडर गाईड देखें. बोलीदाताओं से अनुरोध किया जाता हैं कि एमएसटीसी लिमिटेड के वेबसाइट के माध्यम से ऑनलाइन अपनी बोली प्रस्तुत करें । ऑनलाइन के माध्यम से बोली प्रस्तुत करने हेत् विस्तृत विवरण एनआईटी में दिए गए हैं ।

शुद्धिपत्र, यदि कोई हो, के लिए बोलीदाता को नियमित आधार पर एनएमडीसी की वेंबसाइट/सीपीपी पोर्टल/एमएसटीसी वेबसाइट को देखना अपेक्षित है । अतिरिक्त स्पष्टीकरण के लिए मुख्य महाप्रबंधक (संविदा), एनएमडीसी लिमिटेड,

मुख्य महाप्रबंधक (संविदा)

फेड दर वृद्धिः शुरुआती गिरावट के बाद बाजार में तेजी के आसार

नई दिल्ली, 5 मई

अमेरिकी फेडरल रिजर्व (अमेरिकी फेड) द्वारा अनुमान से पहले वृद्धि की आशंका के साथ साथ बढ़ती मुद्रास्फीति (जो रूस-यूक्रेन युद्ध के बीच अमेरिका में मार्च 2022 में 8.5 प्रतिशत की चार दशक की ऊंचाई पर पहुंच गई) का वैश्विक इक्विटी बाजारों पर नकारात्मक प्रभाव पड़ा है। इन घटनाक्रम की

प्रमुख सूचकांकों - सेंसेक्स और पिछले 6 महीजों में निफ्टी-50 में करीब 5-5 प्रतिशत की

वजह से पिछले 6 महीनों में भारत के

अमेरिकी केंद्रीय बैंक ने कहा है कि राबोबैंक इंटरनैशनल के विश्लेषक पहले ही मुद्रास्फीति से मुकाबले से मुकाबले की स्थिति में हैं। व्यक्तिगत खपत में बदलावों पर आधारित मुद्रास्फीति को मापने वाला व्यक्तिगत खपत खर्च (पीसीई) मानक मार्च में 6.6 प्रतिशत पर पहुंच गया,

जो फेड के 2 प्रतिशत के लक्ष्य से ऊपर है। राबोबैंक ने कहा कि प्रमुख पीसीई डिफ्लेटर मार्च में 5.2 प्रतिशत था जिससे संकेत मिलता है कि लक्ष्य के मुकाबले प्रतिफल नहीं रहा। सीपीआई के संदर्भ में यह खराब दिख रहा है, क्योंकि मार्च में खाद्यान संबंधित मुद्रास्फीति 8.5 प्रतिशत और मुख्य मुद्रास्फीति 6.5 प्रतिशत रही।

राबोबैंक इंटरनैशनल में वरिष्ठ अमेरिकी रणनीतिकार फिलिप मरे ने एक ताजा रिपोर्ट में लिखा है, 'फेडरल को जीडीपी वृद्धि के आंकड़े के जरिये निराशा हाथ लगने की संभावना है, लेकिन खपत और निवेश मजबूत बना रह सकता है, भले ही मुद्रास्फीति तेजी से बढी है। अमेरिकी फेड द्वारा दर वृद्धि का कदम उठाए जाने और बैलेंस शीट कटौती की घोषणा किए जाने की संभावना है। मई की बैठक में हमें 50 आधार अंक वृद्धि का अनुमान है।' लेकिन सवाल यह उठाता है

भारत के प्रमुख सूचकांकों सेंसेक्स और निफ्टी-50 में करीब ५-५ प्रतिशत की गिरावट आई है

कि दर वृद्धि वाकई में बाजारों के लिए खराब है। अमेरिकी फेड द्वारा इस साल 6-7 दर वृद्धि का अनुमान है, जिनमें से कुछ में कम दर वृद्धि का अनुमान है और अमेरिकी अर्थव्यवस्था में मंदी की आशंका है। विश्लेषकों को दर वृद्धि से संबंधित त्वरित प्रतिक्रिया के बाद इक्विटी बाजारों में जल्द सुधार की उम्मीद है।

वेलेंटिस एडवायजर्स के संस्थापक एवं प्रबंध निदेशक ज्योतिवर्द्धन जयपुरिया ने कहा, 'वर्ष 2004 से 2006 के चक्र में, अमेरिकी फेड ने 17 बार 25 आधार अंक तक की दर वृद्धि की थी। समान अवधि के दौरान निफ्टी तेजी से चढा, हालांकि डाउ जोंस (डीजेआईए) में सिर्फ 7.2 प्रतिशत तक की तेजी आई। 2015 के दौरान अमेरिकी केंद्रीय बैंक ने 2.25 प्रतिशत तक की दर वृद्धि की थी।

Date: May 05, 2022

Raman Kumar Jha Company Secretary & Compliance Officer Place: New Delhi

हर एक काम देश के नाम (Membership No. F8086)

<u>डरपाती</u> इरादा

શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મસભા સહિતના કાર્યક્રમ સંપન્ન

સમગ્ર ભારતના ભૂદેવોને એક મંચ પર લાવી સંગઠિત કરાશે: રાકેશ ત્રિપાઠી

વાપીમાં પરશુરામ જયંતિની ઉજવણીએ ધર્મસભામાં ભૂદેવો ઉમટ્યા

અખિલ ભારતીય બ્રહ્મસમાજ વાપી દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બ્રહસમાજ વાપી દ્વારા નિકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડયા હતાં. આ શોભાયાત્રાની શરૂઆત શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજ વાપીના કર્મકાંડી ભુદેવો દ્વારા શાસ્ત્રક્તવિધિથી ભગવાનની પૂજા કરી મહાઆરતી બાદ ભારતભરના ભુદેવો એકત્ર શોભાયાત્રાની શરૂઆત થઇ હતી. ભીલાડના સંત સ્વામી, મોટાપોંઢા આશ્રમના વિજ્ઞાન સ્વામીજી, ભીલાડના વિશ્વ સ્વરૂપ સ્વામી, ઉત્તર ભારતીય,

ગુજરાત,રાજસ્થાન, હરિયાણા વગેરે વિસ્તારના વાપીમાં વસતાં ભુદેવો જોડાયા હતાં. સહકાર મિત્ર મંડળે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરાયુ હતું.સમસ્ત ગુજરાતી બ્રહમસમાજ વાપીના ટ્રસ્ટી શરદભાઇ ઠાકર, ચૈતન્યભાઇ ભક્ટે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામજીની કૃપાથી આજે વાપીમાં સમગ્ર થયા છે.

એક મંચ ઉપર લાવી સંગઠિત કરવાનો મારો લક્ષ્યાંક છે. સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના



સલવાવ ખાતે યોજાયેલી ધર્મસભામાં અનેક મહાનુભાવોએ પ્રવચન આપ્યા

તિવારી,સુભાષ

પ્રમુખ મિતેશ ત્રિવેદી, અમિત તમામ ભુદેવોને એકત્રિત થવાની સમગ્ર ભારતના ભુદેવોને ભટ્ટ સહિત તમામ હોદેદારોએ જરૂર હોવાનું જશાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે કાર્યક્રમમાં વાપી બ્રહમસમાજની જહેમત ઉઠાવી હતી. પપ્પુ મોટી સંખ્યામાં મહિલાઓએ પણ તિવારીએ ભાગ લીધો હતો.

પલસાણામાં અજાણ્યા વાહનની અડફેટે બાઇક્સવાર બે ના મોત

ભાસ્કર ન્યૂઝ | પલસાણા

પલસાણા તાલુકાના વીંઝોડિયા ગામે પાછલા ફળિયામાં રહેતાં નીતિનભાઈ ઠાકોરભાઈ હળપતિ પોતાની મોટરસાયકલ બજાજ પ્લેટીના GJ 19 BB 9959 પર સાઢુભાઈ નવીનભાઈ છોટુભાઈ રાઠોંડને લઈ નવસારી ખાતે છક્રીના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જે દરમિયાન પરત ફરતી વખતે બુધવારે મોડી રાતે 10 વાગ્યાના અરસામાં પલસાણા ગામની સીમના સાબર હોટલની સામે ને.હા.48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેંક પર મોટરસાયકલને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બને મોટરસાયકલ સવાર રોડ પર પટકાયા હતા. જેમાં નવીન રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો નીતિનભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી

<u>Cha</u>nge of Name

સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા

બાદ પ્રાથમિક સારવાર આપી વધુ

સારવાર માટે સુરતની નવી સિવિલ

I have changed My Old Name **ALIYYHA AKEEL AHMED ISANE** To New Name **ALIYYAH AKEEL AHMED ISANE** and I will now be known by my New Name Only

House No.14/33/ B/1/5th 1 Sai Sarvodaya Society, Nani Daman,

CHANGE OF NAME

I am Declaring that have changed My Old Name AKEEL AHMED **ISANE** To New Name AKEEL AHMED **AKHTAR ISANE** and I will now be known by my New Name Only

House No.14/33/ B/1/5th 1 Sai Sarvodaya Society, Nani Daman District Daman,

દિનકરરાય દેસાઇ

₹4. ता. 6-5-2021

લઈ જતી વખતે 108 એમ્બ્યુલન્સમાં જ તેમનું મોત થયું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર હસમુખ હળપતિએ પ્રોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



FILATEX INDIA LIMITED CIN: L17119DN1990PLC000091

Registered Office: Survey No. 274, Demni Road, Dadra, Union Territory of Dadra and Nagar Haveli – 396191 Tel.: 0260-2668343, 2668510, Fax: 0260-2668343, 2668344 Bhageria House 43, Community Centre, New Friends Colony, New Delhi - 110025 **Phone:** 011-26312503, 26848633/44, **Fax:** 011-26849915 Contact Person: Mr. Raman Kumar Jha, Company Secretary & Compliance Officer

FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF FILATEX INDIA LIMITED ("THE COMPANY") (TO WHOM THE LETTER OF OFFER DATED APRIL 29, 2022, ALONGWITH TENDER FORM AND SHARE TRANSFER FORM, HAS BEEN DISPATCHED THROUGH EMAIL WHOSE E-MAIL IDS WERE AVAILABLE AND TO THE SHAREHOLDERS, HOLDING SHARES IN PHYSICAL MODE AND WHOSE EMAIL IDS WERE NOT AVAILABLE, PRINTED COPIES HAVE BEEN DISPATCHED AT THEIR LAST KNOWN ADDRESSES THROUGH PHYSICAL POST ON MAY 04, 2022 FOR THE BUYBACK OF EQUITY SHARES THROUGH TENDER OFFER ROUTE, UNDER THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (BUY-BACK OF SECURITIES) REGULATIONS,

The Company proposed an offer for buyback of upto 42,50,000 (Forty Two Lakh and Fifty Thousand Only) fully paid-up equity shares of the Company of face value of Rs. 2/- (Rupees Two Only) each ("equity shares") at a price of Rs. 140/- (Rupees One Hundred Forty Only) per equity share on a proportionate basis through the tender offer process. The brief schedule of activities for the buyback is as

follows:		
Activity	Date	Day
Completion of Dispatch of Letter of Offer	May 04, 2022	Wednesday
Buyback Opening Date	May 09, 2022	Monday
Buyback Closing Date	May 23, 2022	Monday
Last date for the receipt of completed Tender Forms and other specified documents	May 23, 2022	Monday
including physical chara cortificator (ac applicable) by the Bogistrar to the Buyback		

It may please be noted that even the Eligible Shareholders holding Equity Shares in physical form are eligible to tender their

For the purpose of this Buyback offer the Eliqible Shareholders means the person(s) eliqible to participate in the Buyback Offer and would mean all Equity Shareholders/ beneficial owners of Equity Shares of the Company as on the Record Date being Friday, April 08, 2022.

For detailed process of tendering of shares (by physical shareholders as well as the shareholders holding shares in dematerialised orm), please refer to para 20 at page number 50 of the Letter of Offe

It may please be noted that the application of tendering shares either by physical shareholders or shareholders holding shares in dematerialised form is to be made through stock exchange mechanism only, by Acquisition Window of the National Stock Exchange of India Limited ("NSE").

If in case, any shareholder has not received the Letter of Offer, then he/she may participate in the Buyback either by providing application in writing to the stock broker, on plain paper signed by the Equity Shareholder stating name, address, folio number, number of Equity Shares held, share certificate number, number of Equity Shares tendered for the Buyback and the distinctive numbers thereof, enclosing the original share certificate(s), copy of Equity Shareholders' PAN card(s) and executed share transfer form in favour of the Company or they can download the Letter of Offer, Tender Form and share transfer form SH-4 from the websites of the Company, the Registrar to the Buyback, the Stock Exchanges and the Manager to the Buyback at www.mcsregistrars.com, www.nseindia.com, www.bseindia.com and www.corporateprofessionals.com respectively.

The direct web link of the website of the Registrar to Buyback Offer for downloading the Letter of Offer, Tender Form and share transfer form SH-4 is https://mcsregistrars.com/buyback/filatex.php

For more information, you may contact the Manager, the Registrar or the Company Secretary of the Company

MANAGER TO THE BUYBACK OFFER Corporate **Professionals**

Corporate Professionals Capital Private Limited D-28, South Extension Part-1, New Delhi – 110049, India Tel: 011-40622230/ 40622251/ 40622209; Contact Person: Ms. Anjali Aggarwal, Email: mb@indiacp.com

Website: www.corporateprofessionals.com Investor grievance e-mail: mb@indiacp.com SEBI Registration No.: INM000011435 Validity Period : Permanent CIN: U74899DL2000PTC104508

REGISTRAR TO THE BUYBACK

MCS Share Transfer Agent Limited F-65, Okhla Industrial Area, Phase – I, New Delhi, Delhi – 110020, India Tel: +011-41406148/49/52; Fax: +011-41709881

Contact Person: Mr. Amariit Email: admin@mcsregistrars.com SEBI Registration No.: INR000004108 Validity Period: Permanent

CIN: U67120WB2011PLC165872 For and on behalf of Filatex India Limited

Date: May 05, 2022 Place: New Delhi

Raman Kumar Jha Company Secretary & Compliance Officer (Membership No. F8086)

પ્રથમ પુણ્યતિથિ એ શ્રદ્ધાંજિલ

રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,

ાળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને

વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ. પ્રભુ તમારા દિવ્ય

સાસરી પક્ષ

બાબુભાઈ ગોપાળભાઈ ભંડારી (સસરા)

દિપક બાબુભાઈ ભંડારી (સાળો)

પ્રદિપ ભાણાભાઈ ભંડારી (સાઢુભાઈ)

દુાવ પ્રદિપભાઇ ભંડારી (ભાણેજ) દિવ્યાંશી પ્રદિપભાઇ ભંડારી (ભાણેજ)

માત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના...

નીતાબેન ગીરીશભાઈ પટેલ(પત્ની)

વીર ગીરીશભાઈ પટેલ (પૂત્ર)

મિતાંશી ગીરીશભાઇ પટેલ (પુત્રી)

જીયાંશી ગીરીશભાઈ પટેલ (પુત્રી)

્રપ્રથમ પુણ્યતિથિએ ભાવભીની શ્રધ્ધાંજલિ જીવનભર ઝઝુમી અમૃત અમને પાયું, જીવન એવું જીવ્યા કે મૃત્યુ પણ શરમાઈ ગર્યું, આપના ઉચ્ચ આર્શીવાદ, સાત્વિક

ગુર્શો અને અમુલ્ય જીવનના મૂલ્યો અમારા પંથને સદાય પ્રેરજ્ઞા રૂપી પ્રકાશ પાથરી ઉજ્જવળ બનાવે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. અમિત ડી. દેસાઈ દેવેન ડી. દેસાઈ અલકા એ. દેસાઈ અમિતા ડી. દેસાઈ જેનિલ એ. દેસાઈ ધ્રવી ડી. દેસાઈ સ્વ. મંજુલાબેન

સુજાતા એસ. દેસાઈ હાર્દિક, જીગર એસ. દેસાઈ સુનિલ એન. દેસાઈ

ગામ - હરિયા, અતુલ, જિ. વલસાડ







સ્વ. ગીરીશભાઈ

ગોવિંદભાઈ પટેલ

₹4. dl. 6/5/2021

પ્રથમ પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ સમય જીંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી, વિદાય તમાર્ર અણઘારીહશે એક્ચાં ખબરહતી, હે પ્રભુ અમારે હતી જરૂર તેની તમને શી જરૂર પડી, અમારા ખજાનેથી રત્ન લઈ ગયા, આંખે હજી નિહાળે છે તમને, અંતર હજી પોકારે છે તમને, સ્મરણ તમારૂં થાય છે ત્યારે મન મુકીને રડાવે છે અમને. પરમ કૃપાળુ રમાત્મા તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થન આશા રાજેશ પટેલ , મમ્મી ,પપ્પા પુનીબેન નાની , શાંતા બેન દાદી

તા ડાહ્યા ભાઈ પટેલ , કાકી કાકા શ્રમુ ભાઈ એને પટેલ, બાબુ ભાઈ એન પટેલ જીનલ, બોબી,પ્રીન્સ,ક્રિ<u>શિવ,યશ ભાઇ</u> ગામ :અંજલાવ , અતુલ, વલસાડ 🛛 👛

ઉમરગામમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં 15મી મે સુધી નામ નોંધણી ભાસ્કર ન્યૂઝા બીલાડ

ધોડીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા 27 મી મેં નાં રોજ સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું છે.સાંસ્કૃતિક વિકાસ મંડળ નાં પ્રમુખ અને ઉમરગામ તાલુકા નાં ધારાસભ્ય રમણલાલ પાટકર સર્વજ્ઞાતી સમૂહ લગ્ન માં 30 જોડા એ લગ્ને માટે નામ ની નોધણી કરી છે.સર્વજ્ઞાતી સમૂહ લગ્ન નું આયોજન સુંદર રીતે પાર પાડવા માટે લગ્ન ઈચ્છુક યુવક યુવતી ઓ એ 15 મી મે સુધી નામ ની નોધણી કરાવવા જણાવવામાં

WE'RE HIRING!

EXPERIENCE PROFESSIONALS REQUIRED AT LANDMARK HONDA

Positions

Used Car Evaluator/ Evaluation Engineer

WALK IN INTERVIEW Date: 07th May, 2022 Time: 10.00AM to 6.00PM

Location - Landmark Automobiles Ground Floor, Ganga Complex, NH 8 at & Post Salvav, Vapi Gujarat - 396191

Contact Gaurav Patil - 99041 71743 Email ID- gaurav@sheerdrive.in



જन्म ता. १४/०४/१६५२ स्व. ता. ०५/०५/२०२१ ગામ : સરોદ્યી, હાલ - બોરીવલી

પુરૂષાર્થ કરી શૂન્યમાંથી સર્જન કર્યું, કષ્ટ સહન કરી પરીવાર માટે ફૂલો પાથરી ગયા, સુખથી છલકાર્યો નહી, દુ:ખથી ડગ્યા નહી, વ્યવહાર કદી ચૂકયા નહી, ધર્મ કદી ભુલ્યા નહી, જીવન આપ એવુ જીવ્યા છે કે સદા સ્મરણમાં રહે, ક્યાંક કોઈ ફરીયાદ કે દંભ નહી, સાદગી અને મિલનસાર સ્વભાવ, હંમેશા મદદરૂપ થવાની ભાવના ધરાવતા અમારા સ્નેહી આજે અમારી સાથે નથી એવું મન માનતું નથી. રડી પડે છે આંખો અમારી જોઈ પ્યારી તસ્વીર તમારી. આપની અમી દ્રષ્ટિ અને સ્નેહભર્યા આર્શીવાદ સદા અમારી સાથે છે અને રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય અને પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના... ૐ શાંતિ... શાંતિ... શાંતિ...

રણજીતભાઈ દયાળજી દેસાઈ (પતિ) શિતલ રણજીતભાઈ દેસાઈ (પુત્રી) (૬૪) હાઇક રેગાઇ (૧૪) ધ્રુવી ભાવિક દેસાઈ (પુત્રવધુ)

જાહેર નોટીશ

આથી જાહેર જનતાને જણાવવાનું કે,

વલસાડ ડીસ્ટ્રીક્ટની સબ ડીસ્ટ્રીક્ટ પારડી તાલુકાનાં મોજે પરીયા ગામે આવેલ યેડખાતાની **ખાતા નંબર**-૧૭૫૬ થી ચાલતી નીચેના વર્શન અને ક્ષેત્રફળવાળી મીલ્કત જુનો સર્વે નંબર નવો સર્વે નંબર હે.આરે. ચો.મી.

વાળી મીલ્કતના ૭/૧૨ રેકર્ડ દક્તરેના માલીકો **પરીમલભાઈ સુશીલચંદ્ર દેસાઈ** ાથા ધર્મેન્દ્રભાઈ સંશીલચંદ્ર દેસાઈ છે તેઓની પાસેથી મજ **અસીલ કાંતીભાઈ નાથુભાઈ પટેલ** રહેવાસી-પરીયા, બંધાડી નાયકવાડ તાલુકા પારડી, જીલ્લા-વલસાડનાએ કાયદેસરના વેચાણના કુરારના આધારે વેચાણ રાખી કબજે મેળવેલ છે. જે અંગેનો વેચાણનો કરાર **નોટરી એડવોકેટ ભરતકુમાર એમ** પટેલના રેકર્ડ દફતરે બુક નંબર-૦૫, પેજ નંબર-૭૧, સીરીયલ નંબર-૨૭૩૦ ર્થ તારીખ-૦૯/૦૮/૨૦૧૬ ના રોજ નોંધવામા આવેલ છે અને મજકુર વેચાણન કરારના આધારે હમારા અસીલે <mark>પરીમલભાઈ સુશીલચંદ્ર દેસાઈ તથા</mark> **ધર્મેન્દ્રભાઈ સુશીલચંદ્ર દેસાઈને** પાર્ટ પેમેન્ટ પણ ચુકવેલ છે.

હાલ હમારા અસીલની જાણમાં આવેલ છે કે મજકુર જમીનના રેકર્ડ દફ્તરે ચાલી આવતા માલીકો પરીમલભાઈ સુશીલચંદ્ર દેંસાઈ તથા ધર્મેન્દ્રભાઇ સુશીલચંદ્ર દેસાઈ મજકુર જમીન અન્ય ત્રાહિત ઈસમને બારોબાર વેચાણ કરવાની તજવીજ કરી રહેલા છે. જે અંગે હમારા અસીલ તરફે જાહેર કરવાનું ે મજકુર ઉપરોક્ત સર્વે નુંબરવાળી જમીનનો કબજો સને ૨૦૧૬ થી હમારા અસીલનો ચાલી આવેલ છે જેથી મજૂકુર જમીન કોઈપણ પેઢી, સંસ્થા, બેંક ત્રાહિત ઈસમ ઘ્વારા **પરીમલભાઈ સુશીલચંદ્ર દેસાઈ** તથા **ધર્મેન્દ્રભાઇ સુશીલચંદ્ર દેસાઈ**નાઓ જોડે મજકુર મીલ્કત અંગે કોઈપણ તબદીલીના વ્યવહારે કરશે તો તેવી પેઢી, સંસ્થા, બેંક કે ત્રાહિત ઈસમોને હમારા અસીલ જોડે નાહકના તકરારી પ્રકરણોમાં ઉતરવું પડશે તેમજ તેઓને સદર મીલ્કત અંગે કલીયર ટાઈટલ પ્રાપ્ત થશે નહી જેની જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી.

હિતૈશ એમ.પટેલ-એડવોકેટ ઠેકાશું - પરીયા, બરવાડી ફળીયા,તા. પારડી, જી. વલસાડ. મો.નં. ૯૮૨૪૭૮૦૦૯૦ અસીલની સૂચનાથી

હિતેશ એમ.પટેલ તે કાંતીભાઈ નાથુભાઈ પટેલ નાં એડવોકેટ

જાહેર નોટીસ

આથી લાગતી વળગતી તમામ જાહેર જનતાને જાણ કરવાની કે નીચે મિલક્તના વર્ણનમ જ્ણાવેલી મિલકત બિપીચન્દ્ર મણીલાલ દેસાઈના કાયદેસરના સીધીલીટીન વારસદારો (1) મિનાક્ષી બિપીનચંન્દ્ર દેસાઈ, (2) શ્રી સુજલ બિપીન દેસાઈ, બન્ને રુ<u>હે</u>વાસી 20ે3, બેસ્ટ સ્વાસદન, એસ.વી. રોડે, લીલીયા નગર, મોતીલાલ નગર ગોરેગાવ (પશ્ચિમ) મુંબઈ-400104 ના તથા (3) શ્રી જસ્મીત બિપીન દેસાઈ રહેવાસી 203,સોમાં ટાવર,પ્લોટ નં 579 પાલી રોડે, કોરા કેન્દ્ર ની બાજુમાં,ચીકુવાડી **બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-**40092ના ની માલીકીની ચાલી આવેલ છે. મજકુર મિલક્ત તેઓની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટા વહીવટની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે. અને પાર્ટ પેમેન્ટ પણ સ્વીકારેલ છે. જેથી મજકુર મિલક્તમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક કે અન્ય કોઈનો કંઈ પણ પ્રકારનો લાગભાગ, દરદાવો હકક હિસ્સો, અલાખો, અધિકાર લિસપેન્ડન્સ લીયન કે એટેચમેન્ટ ખોરાકી-પોષાકી કે ભરણપોષણનો કે ઇઝમેન્ટનો કે જામીનગીરી, બોજાનો કે સંપાદનનો કે બાનાખત, વારસાઈ વિગેરે સીધી કે આડકતરી રીતે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો કે લાગભાગ હોય તો તેમણે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન -07 (સાત) માં અમોને લેખિતમ જરૂરી અને પુરતા દસ્તાવેજી પુરાવાઓ સહિત પોતાના વાંધાઓ રજુ કરવા અને જો ઉપરની મુદંતમાં કોઈ પણ પ્રકારના વર વાંધાઓ આવશે નહિ તો મજકુર મિલકર્ત પરત્વે કોઇના પણ હક્ક દોવાઓ કે વાંધાનો નથી અને જો તેવા હોય તો તેમણે જતા કરેેલા યાને વેવ કરેલા છે તેવું સમજી અમારા અસીલ મજકુર મિલકતનું ટાઈટલ ચોખ્ખું અને કલીયર છે. તેમ માની રેકર્ડ દફ્તરે ચાલતા જમીન માલીક સાથે મજકુર મિલકતની ખરીદી અંગેના વહેવારો પરીપુર્શ કરાવી લેશે અને તે અંગે પાછળથી કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહિ તેની નોંધ લેશોજી.

<u>મિલકતનું વર્ણન</u>

વલસાડ ડી. ના સબ ડી. ઉમરગામ તાલુકાના મોજે "<mark>વલવાડા</mark>" ગ્રામ પંચાયતની હદમાં આવેલ અને વલવાડા ગામના રેવન્યું રેકર્ડે દફ્તરે નોંધાયેલ ખેતીની જમીનવાળી મિલકત જેનું વિગતવાર વર્શન નીચે મુજબ છે.

3		9					
ગામનું	ખાતા	જુનો સર્વે	ક્ષેત્રફળ હે.ચો.મી.	નવો સર્વે	ક્ષેત્રફળ	આકાર	
વલવાડા	589	149/2	0-59-69	596	0-60-47	2-45	

ઉપરોક્ત કોપ્ટકમાંના વર્શન મુજબની **૦ હેકટર - 60 આરે - 47 પ્રતિઆરે** વાળી ખેતીની જમીન તથા તેમાં આવેલ ઝાડ, બીડ તથા તેમાં જાવ આવ કરવાના હક્કો તથા સુખાધિકારે

મારી સુચનાથી

સરનામું: 201, ભાનુજયોત કોમ્પલેક્ષ, પંચરત્ન કોમ્પલેક્ષની પાછળ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી., વાપી, તા. વાપી, જી. વલસાડ. તારીખ : 06-05-2022

સહિ/-એલ.જી ભાનુશાલી તે ખરીદનારના એડવોકેટ

બી.એ.એમ.એસ. પ્રવેશ જાહેરાત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગરથી જોડાયેલ શ્રી આર.એમ.ડી. આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, વાઘલધરા ખાતે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બી.એ.એમ.એસ. (આયુર્વેદાચાર્ય) શૈક્ષણિક ક્ષેત્રના એ.સી.પી.યુ.જી.એમ.ઈ.સી.ના ચોથા ઓફ્લાઈન રાઉન્ડ પછી ખાલી રહેલ બેઠકો હેઠળે શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની સુવર્ણ તક, મર્ચાદિત બેઠકો ખાલી પડેલ હોવાથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

પ્રવેશ માટેની અંતિમ તારીખ : 09-05-2022, સમય બપોરે 1:00 વાગ્યા સુધીમાં જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ જમા કરાવવાનુ.

પ્રવેશ સમિતિના અને NCISM / AYUSH દ્વારા નિયુક્ત નિયમો અનુસાર લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા પાત્ર રહેશે.

કોલેજની વિશેષતા : • કુદરતી વાતાવરણની વચ્ચે આધુનિક કોલેજ કેમ્પસ • છોકરીઓ અને છોકરાઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ • મેસની સુવિધા ઉપલબ્ધ • 24x7 ઈમરજન્સી સેવા • કવાલીફાઈડ અને અનુભવી . ફુલટાઈમફેકલ્ટી • સંલગ્નસ્પેશ્યાલિટીહોસ્પિટલ

SHREE RMD AYURVED COLLEGE AND HOSPITAL

(Governed by : Prabhav Hem Kamadhenu Girlvihar Trust -Kesaursuri Gyanvihar Sanku, NH-48, At Post - Waghaldhara - 396375. Dist - Valsad, Mob.: 63588 17577, 81410 07556 Email : rmdayucollege@gmail.com website : www.girivihartrust.org

PUBLIC NOTICE FOR LOST TITLE DOCUMENT Notice Public at large that the property mentioned

hereunder, in which Mr. Chakravir Kishorbhai Parekh has approached my client Bank State Bank of India - Khergam, Ta. Khergam, Dist. Navsari to avail Housing Loan by way of purchasing the property mentioned hereunder. Mr. Chakravir Kishorbhai Parekh going to purchase the property from its registered owners viz. Mrs. Mayuriben Sanjaybhai Pawar followed the respective permission for sale by the competent authority, she purchased the captioned property i.e. property situated at Village Khergam Ta. Khergam Dist. Navsari bearing Residential Plot No. 105 for admeasuring 112.24 sq. mtrs. bearing Block/Survey No. 3826 (old S. No. 789/A/1/105) Project named after **'Shayona Residecy'.** But in chain of thé title, the document mentioned in following schedule is misplaced and it is not in physical possession of it's registered owner. Therefore, whoever has such rights, interest, mortgage or any such claim/s on the said property as well as the said documents kindly inform me by R.P.A.D. Post within the 7 days by published this Public-Notice. Failed to do so, I will issue Title Investigation Report on above owned favours and my client will be undergone for loan procedure relating to the aforesaid property. No such claim/s will be entertained thereafter.

Details of lost Documents referred herein Original Registration Receipt (R.R.) of Sale-Deed No. 69/2013 $dated\,11/01/2013\,registered\,in\,Sub\text{-Registrar},\,Office,\,Chikhli,$ Dist. Navsari

Date: 05/05/2022 Office: 111, Rudraksh Complex, Opp. Avabai High school Ground, Valsad, Ta. Dist. Valsad - 396001 Mo. No. 89802 56882

Through myself JAVED A. SHAIKH B.A.,LL.B. ADVOCATE & NOTARY

જાહેર નોટીસ

આથી લાગતી વળગતી તમામ જાહેર જનતાને જાણ કરવાની કે નીચે મિલકતના વર્શનમાં જણાવેલી મિલકત બિપીનચંદ્ર મણીલાલ દેસાઈના કાયદેસરના સીધીલીટીના જ્યાવેલી મિલકત બિપીનચંદ્ર મણીલાલ દેસાઈના કાયદેસરના સીધીલીટીના વારસદારો (1) મિનાક્ષી બિપીનચંદ્ર દેસાઈ, (2) શ્રી સુજલ બિપીન દેસાઈ, બંને રહેવાસી : 203, બેસ્ટ સ્વાસદન, એસ.વી. રોડ, લીલીયા નગર, મોતીલાલ નગર, ગોરેગાંવ (પશ્ચિમ), મુંબઈ - 400104ના, (3) શ્રી જસ્મીત બિપીન દેસાઈ, રહેવાસી : 203, સોમા ટાવર, પ્લોટ નં. 579, સીમ્પોલી રોડ, કોરા કેન્દ્રની બાજુમાં, ચીકુવાડી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ - 400092, (4) શ્રી સુરેશચંદ્ર મણીલાલ દેસાઈ, રહેવાસી : બી/35, શિવસદન, ગુંજન, અંબામાતા મંદિરની પાછળ, જી.આઈ.ડી.સી., વાપી, તા. વાપી, જી. વલસાડ, તથા (5) શ્રી મહેન્દ્ર મણીલાલ દેસાઈ, રહેવાસી : દેસાઈ ફળીયુ, વલવાડા, તા. ઉમરગામ, જી. વલસાડનાઓની સંયુક્ત માલીકીની ચાલી આવેલ છે. મજકુર મિલકત તેઓની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટા વહીવટની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અને પાર્ટ પેમેન્ટ પણ સ્વીકારેલ છે. જેથી મજકુર મિલકત તો કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક કે અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો લાગભાગ, દરદાવો, હક્ક હિસ્સો, અલાખો, અધિકાર, લીસપેન્ડન્સ, લીયન કે એટેચમેન્ટ, ખોરાકી-પોષાકી કે ભરણપોષણનો કે ઈઝમેન્ટનો કે જામીનગીરી, બોજાનો કે સંપાદનનો કે બાનાખત, વારસાઈ વિગેરે સીધી કે આડક્તરી રીતે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક હિત કે હિસ્સો કે લાગભાગ હોય તો તેમણે આ નોટિસ પ્રસિધ્ધ અન્ય કોઈપર્શ પ્રકારનો હક્ક હિત કે હિસ્સો કે લાગ[ં]ભાગ હોય તો તેમણે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-07 (સાત) માં અમોને લેખિતમાં જરૂરી અને પુરતા દસ્તાવેજી પુરાવાઓ સહિત પોતાના વાંધાઓ રજુ કરવા અને જો ઉપરની મુદ્દતમાં કોઈ પણ પ્રકારના વર વાંધાઓ આવશે નહિ તો મજકુર મિલકત પરત્વે કોઈના પણ હક્ક દાવાઓ કે વાંધાઓનથી અને જો તેવા હોય તો તેમણે જતા કરેલા યાને વેવ કરેલા છે તેવું સમજી અમારા અસીલ ગુજકુર મિલકતનું ટાઈટલ્સ ચોખ્ખુ અને ક્લીયર છે તેમ માની રેકર્ડ દફ્તરે ચાલતા જમીન માલીક સાથે મજકુર મિલકતની ખરીદી અંગેના વહેવારો પરીપુર્ણ કરાવી લેશે અને તે અંગે પાછળથી કોઈની કોઈ પણ પ્રકારની તકરાર ચાલશે નહિ તેની નોંધ લેશોજી.

<u>મિલકતનું વર્ણન</u>

<mark>વલસાડ ડી. ના ૨જી. સબ ડી. ઉમરગામ તાલુકાના મોજે "વલવાડા"</mark> ગામે વલવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ અને વલવાડા ગામના રેવન્યુ રેકર્ડ દફ્તરે નોંધાયેલ ખેતીની ૪મીન વાળી મિલકત જેનું વિગતવાર વર્શન નીચે મુજબ છે.

			ક્ષેત્રફળ				
નામ	નંબર	નંબર	હે.ચો.મી.	નંબર	હે.ચો.મી.	રૂા. પૈસા	
યલવાડા	867	150/1	0-42-23	594	0-42-23	1-69	
12) (- 1							

ઉપરોક્ત કોષ્ટકમાંના વર્શન મુજબની 0 હેકટર - 42 આરે - 23 પ્રતિઆર વાળ્ ખેતીની જમીન તથા તેમાં આવેલ ઝાડ, બીડ તથા તેમાં જાવ આવ કરવાના હક્કો તથા સખાધિકારો સહિતની મિલકત.

મારી સુચનાથી સહિ/-સરનામુંઃ 201, ભાનુજ્યોત કોમ્પલેક્ષ,

પંચરત્ને કોમ્પલેક્ષની પાછળ, ચાર રસ્તા, જી.આઈ.ડી.સી.. વાપી. તા. વાપી. જી. વલસાડ. તે ખરીદનારના એડવોકેટ તારીખ : 06-05-2022

સહિ/-એલ.જી ભાનુશાલી

જાહેર નોટીશ આથી આ જાહેર નોટીશ રૂએ લગતા, લાગતા, વળગતા તમામને જણાવવામાં

આવે છે કે, નીચેના "શીડયુલ" માં જણાવેલ મીલ્કત વાપી, જી.આઈ.ડી.સી. ના રેકર્ડ દક્તરે આઈકોન એરોમેટીક્સ કેમ એલએલપી (I K O N AROMATICS CHEMLLP) નામની ભાગીદારી પેઢીના નામે ચાલે છે. સદરહું ભાગીદારી પેઢીના ભાગીદાર રમેશ ગીરધરલાલ તુરખીયા તારીખ 13.0².2020 ના રોજ મુબઈ મુકામે અવસાન પામેલા છે. ઍને મરહુમ રમેશ ગીરધરલાલ તુરખીયાના કાયદેસરના સીધીલીટીના વારસદારો 1. ઉર્મિલાબેન રમેશભાઈ તુરંખીયા, 2. મીતા વિક્રમ કામદાર તે રમેશભાઈ તુરખીયાની દીકરી, 3. પુર્વી ચેતન મિર્સ્ત્રી તે રમેશભઆઈ તુરખીયાની દીકરી, તથા 4. ચિરાગ

1. ઉર્મિલાબેન રમેશભાઈ તુરખીયા, 2. મીતા વિક્રમ કામદાર તે રમેશભાઈ તુરખીયાની દીકરી, તથા ૩. પુર્વી ચેતન મિસ્ત્રી તે રમેશભાઈ તુરખીયાની દીકરીએ નીચેના શીક્યુલમાં જણાવેલ મીલ્કતમાંથી તેમનો વગર વહેંચાયેલો હક્ક, હિસ્સો તેમના દીકરા/ભાઈ **ચિરાગ રમેશભાઈ તુરખીયા** ની તરફેણમાં સરન્ડર યાને ત્યજી દીધેલા છે. જેથી વાપી, જીઆઈડીસી ના રેકર્ડ દફતરે નીચે શીક્યુલમાં જ્ણાવેલ મીલ્કતના કાયદેસરના માલીકો / ભાગીદારો 1.કુમારભાઈ બલવંતરાય મહેતા તથા 2.ચિરાગ રમેશભાઈ તુરખીયા છે. નીચે શીક્યુલમાં જણાવેલ મીલ્કત વાપી, જી.આઈ.ડી.સી. ના રેકર્ડ દફ્તરે

આઈકોન એરોમેટીક્સ કેમ એલએલપી ના ભાગીદારો 1. કુમારભાઈ બલવંતરાય મહેતા તથા 2. ચિરાગ રમેશભાઈ તુરખીયા ના નામે ટ્રાન્સફર કરવામાં આવે તો કોઈનો કોઈપણ પ્રકારને લાગ, ભાગ, દર દાવો, હક્ક હીસ્સો કે અન્ય પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ હક્ક દાવાઓ હોય, તેવા ઈસમોએ આ નોટીસ પ્રસિધ્ધ થયે **દિન-07 (સાત)માં** હમારો યોગ્ય પુરાવાઓ સાથે સંપર્ક કરવો અને એ ઉપયુક્ત સમય મર્યાદા દર્ગમ્યાન કાંઈ વાંધાઓ મળી આવશે નહી તો તેવે વખતે હમારૂ માનવું રહેશે કે જે તે ઈસમોએ તેમના હક્ક દાવાઓ હમારા અસીલની તરફેશમાં સરન્ડર યાને ત્યજી દીધેલા છે. અને ત્યારબાદ ની શીક્યુલવાળી મીલ્કતની કોઈપણ પ્રકારની તકરાર ગ્રાહય રાખવામાં આવશે નહી. ર્જની આ નોટીશ રૂએ લાગતાં વળગતાઓએ નોંધ લેવી.

<u>શીડ્યુલ</u>

વલસાડ ડીસ્ટ્રીક્ટના રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ ઉમરગામ તાલુકાના મોજે સરીગામ મધ્યે આવેલ ઈન્ડસ્ટ્રીયલ શેડ નં. સી1/630 ની 704 ચો.મી. ના ક્ષેત્રફળવાળી મીલકત તથા તેને લગતા, લાગતા, વળગતા તમામ પ્રકારના હક્કો સહિતની મીલકત.

સરનામું : શોપ નં. ૩, સ્નેહદિપ કોર્મશીયલ કોમ્પલેક્ષ, સુરત પીપલ્સ કો.ઓ.બેંકની બાજુમાં, નેં.હા. નં. 8,જી.આઈ.ડી.સી. વાપી, તા. પારડી, જિ. વલસાડ.

E-mail: rnmehta.adv@gmail.com

મો. 98255 40552,

લિ. કુમારી રશ્મિકા એન. મહેતા (એડવોકેટ એન્ડ નોટરી)